



પોલીસ કમિશનરની કચેરી, સુરત શહેર.  
 પોલીસ ભવન, અઠવાલાઇન્સ, સુરત શહેર-૩૮૫૦૦૧  
 વિશેષ શાખા, કચેરી ટેલીફોન-૦૨૬૧ ૨૨૪૯૧૧૦  
 કંદ્રોલ રૂમ ફેક્સ નં. ૦૨૬૧ ૨૨૪૯૩૦૪  
 e-mail : special.cp.sur@gmail.com



એક કદમ સચ્છેદા કો જોર

## -:: ફોજદારી કાર્યરીતી અધિનીયમ-૧૯૭૩ (૧૯૭૪ના નં.૨) ની કલમ-૧૪૪

ક્રમાંક: એસ.બી./ઇડ-એ-મિલાદ- ૧૯૬/૨૦૨૧

### વંચાણે લીધા

(૧) ગૃહવિભાગ સચિવાલય ગાંધીનગર ક્રમાંક: વિ-૧/કઅવ/૧૦૨૦૨૦/૪૮૨- B તા. ૧૭/૧૦/૨૦૨૧

(૨) અતેની કચેરીના ક્રમાંક : એસ.બી./ઇડ-એ-મિલાદ- ૧૯૩/૨૦૨૧

૧. રાજ્યમાં covid-19 ના સંક્રમણની બાબતને ધ્યાને લેતા રાજ્ય સરકાર દ્વારા ગૃહ વિભાગના તા. ૨૪/૦૬/૨૦૨૧ ના હુકમ ક્રમાંક: વિ-૧/કઅવ/૧૦૨૦૨૦/૪૮૨- B થી સમગ્ર રાજ્યમાં કેટલાક નિયંત્રણો અમલમાં મુકવામાં આવેલ છે. જેની અવધી ગૃહ વિભાગના તા. ૦૮/૧૦/૨૦૨૧ ના હુકમ ક્રમાંક: -વિ-૧/કઅવ/૧૦૨૦૨૦/૪૮૨- B થી તા. ૧૦/૧૦/૨૦૨૧ ના સવારના ૦૬/૦૦ કલાક થી તા. ૧૦/૧૧/૨૦૨૧ ના સવારના ૦૬/૦૦ કલાક સુધી લંબાવવામાં આવેલ છે. જ્યારે ગૃહ વિભાગના તા. ૨૪/૦૬/૨૦૨૧ ના હુકમ ક્રમાંક: વિ-૧/કઅવ/૧૦૨૦૨૦/૪૮૨- A થી રાજ્યના ૦૮ મહાનગરોમાં રાત્રી કર્ફ્યુ તથા કેટલાક નિયંત્રણો અમલમાં મુકવામાં આવેલ છે. જેમાં કોઈ પણ પ્રકારના સાંસ્કૃતિક, ધાર્મિક, રાજકિય કે સામાજિક પ્રસંગોમાં ૪૦૦ વ્યક્તિઓની મર્યાદામાં એકટા થવાની છુટ આપવામાં આવી છે. જેની અવધી ગૃહ વિભાગના તા. ૦૮/૧૦/૨૦૨૧ ના હુકમ ક્રમાંક: -વિ-૧/કઅવ/૧૦૨૦૨૦/૪૮૨ - A થી તા. ૧૦/૧૦/૨૦૨૧ ના સવારના .૦૬/૦૦ કલાકથી તા. ૧૦/૧૧/૨૦૨૧ ના સવારના ૦૬/૦૦ સુધી લંબાવવામાં આવેલ છે.

૨. આ ઉપરાંત ગૃહ મંત્રાલય, ભારત સરકાર દ્વારા પણ તા. ૨૮/૦૬/૨૦૨૧ ના હુકમથી આગામી તહેવારોને અનુલક્ષીને માર્ગદર્શક સુચનાઓ આપેલ છે.

૩. તા. ૧૬/૧૦/૨૦૨૧ના રોજ ઇડ-મિલાદન્બી સલલ્લલાહુ અલયહે વઆદેહી વસલ્લમ ( ઇડ-એ-મિલાદ) ના તહેવારની ઉજવણી કરવામાં આવનાર છે. જે સંદર્ભ જુલુસ સહીતના અન્ય કાર્યક્રમની ઉજવણી કરવાની મંજૂરી આપવા અંગે મળેલ રજુઆત સંદર્ભે રાજ્ય સરકાર દ્વારા નીચે નિર્ણય લેવામાં આવેલ છે.

વાસ્તે, હું અજ્યકુમાર તોમર(આઇ.પી.એસ.) પોલીસ કમિશનર, સુરત શહેર, ફોજદારી કાર્યરીતી અધિનીયમ -૧૯૭૩ (૧૯૭૪ના નં.-૨)ની કલમ-૧૪૪ અન્વયે મને મળેલ સત્તાની રૂપોં નીચે મુજબ હુકમ કરું છું.

### -હુકમ :-

- ઇડ-એ-મિલાદના તહેવાર સંદર્ભે જો કોઈ ધાર્મિક યાત્રા શેરી, મહોલ્લા અથવા તો કોઈ મર્યાદિત વિસ્તારમાં ફરવાની હોય તો તેમાં અગાઉના તા. ૨૪/૦૬/૨૦૨૧ ના જાહેરનામાં અનુસાર કોવિડ-૧૯ ગાઇડ લાઇનના પાલન સાથે એક જ વાહન અને મહત્વમાં ૪૦૦ વ્યક્તિઓની મર્યાદામાં લોકો ભાગ લઈ શકશે. પરંતુ જો આ યાત્રા એક થી વધુ મહોલ્લા/સ્થાનિક વિસ્તારમાંથી જુલુસ સ્વરૂપે નિકળનાર હોય તો તેમાં તા. ૧૭/૧૦/૨૦૨૧ ની જોગવાઇઓ અનુસાર મહત્વમાં ૧૫ માણસોની મર્યાદામાં લોકો ભાગ લઈ શકશે.
- ઇડ-એ-મિલાદના જુલુસનું આયોજન માત્ર દિવસ દરમિયાન જ કરી શકાશે.
- ઇડ-એ-મિલાદ નું જુલુસ જે વિસ્તારનું હોય તે વિસ્તારમાં જ ફરી શકશે અને શક્ય તેટલા ઓછા સમયમાં પૂર્ણ કરવાનું રહેશે.
- ઇડ-એ-મિલાદના જુલુસ અને અન્ય ઉજવણી દરમિયાન કોવિડ-૧૯ ગાઇડ લાઇનનું યુસ્તપણે પાલન કરવાનું રહેશે.

### -વિસ્તાર:-

સુરત શહેર પોલીસ કમિશનરેટ હુકમત હેઠળનો સમગ્ર વિસ્તાર.

અમલવારીનો સમય ::

સુરત શહેર પોલીસ કમિશનર હુકમત હેઠળના સમગ્ર વિસ્તારમાં તા. ૧૬/૧૦/૨૦૨૧ ના કલાક:૦૦/૦૦ થી  
તા. ૧૬/૧૦/૨૦૨૧ ના કલાક:૨૪/૦૦ સુધી આ હુકમનો અમલ કરવાનો રહેશે.

:શિક્ષા:-

આ હુકમનો ભંગ કરનાર અથવા ઉલ્લંઘન કરનાર ભારતીય ફેજદારી અધિનિયમ સને-૧૮૬૦ ની  
કલમ ૧૮૮, ની જોગવાઈ મુજબ શિક્ષાને પાત્ર થશે.

-:જાહેર વિજાપન:-

હું આથી આદેશ આપું છું કે, આ હુકમની જાહેરાત ઉપર જણાવેલ વિસ્તારોમાં સહેલાઇશી દેખી શકાય  
તેવી જગ્યાઓએ તેની નકલ ચોટાડી, લાઉં સ્પીકર વાહન દ્વારા તેમજ સ્થાનિક વર્તમાન પત્રો, આકાશવાણી અને દુરદર્શન  
કેન્દ્રો ઉપરથી પ્રસિદ્ધ કરાવવું.

આ હુકમ અન્વયે સુરત કમિશરેટમાં ફરજ બજાવતા અનાર્મ આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર અને તેનાથી  
ઉપરના દરજાના કોઇ પણ પોલીસ અધિકારીશ્રીઓને આ જાહેરનામાંનો ભંગ કરનાર ઇસમો સામે ભારતીય ફેજદારી  
અધિનિયમ સને-૧૮૬૦ ની કલમ ૧૮૮, મુજબ ફરીયાદ માંડવા માટે અધિકૃત કરવામાં આવે છે.

આજ તા. ૧૮/૧૦/૨૦૨૧ ના રોજ મારી સહી અને સિક્કા કરી આપેલ છે.



(અધ્યક્ષમાર સ્ટેમ્પ)  
પોલીસ કમિશર,  
સુરત શહેર.

પ્રતિ,

- (૧) અધિક પોલીસ કમિશરશ્રી, સેકટર-૧,૨ તથા ટ્રાફિક એન્ડ કાઇમ સુરત શહેર.
- (૨). નાયબ પોલીસ કમિશરશ્રી, તમામ, સુરત શહેર
- (૩). મદદનીશ પોલીસ કમિશરશ્રી, તમામ સુરત શહેર
- (૪). તમામ પો.સ્ટે./ શાખા ઈન્યાર્જશ્રીઓ, સુરત શહેર. (નકલો ચોટાડી લાઉં સ્પીકર, વાહન દ્વારા જાહેરાત કરાવવા સારુ)
- (૫) કંદ્રોલ ઈન્યાર્જશ્રી, સુરત શહેર (તમામ વર્તમાનપત્રો તથા ન્યુઝ ચેનલોને એક-એક નકલ આપવી).

સંવિનય નકલ રવાના :-

- (૧) અધિક મુખ્ય સચિવશ્રી, ગુહ વિભાગ, ગાંધીનગર.
- (૨) પોલીસ મહાનિદેશકશ્રી અને પોલીસ મહાનિરીક્ષકશ્રી, ગુ.રા., ગાંધીનગર.
- (૩) અધિક પોલીસ મહાનિદેશકશ્રી (ઇન્ફે.), ગુ.રા., ગાંધીનગર.
- (૪) પોલીસ કમિશરશ્રી અમદાવાદ શહેર, રાજકોટ શહેર/વડોદરા શહેર.
- (૫) પોલીસ મહાનિરીક્ષકશ્રી સુરત રેઝ, સુરત.
- (૬) કલેક્ટરશ્રી, સુરત શહેર.
- (૭) મ્યુનિસિપલ કમિશરશ્રી, સુરત શહેર
- (૮) નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી, (ઇન્ફે.) સુરત રીજિયન, સુરત
- (૯) પોલીસ અધિક્ષકશ્રી, સુરત રૂરલ.
- (૧૦) નિયામકશ્રી, માહિતી ખાતુ, ગુ.રા., ગાંધીનગર.
- (૧૧) જીલ્લા સરકારી વકીલશ્રી, સેસન્સ કોર્ટ, સુરત.
- (૧૨) મેનેજરશ્રી, ગર્વનેન્ડ પ્રેસ વડોદરા, (ગેઝેટ ભાગ-૧ માં પ્રસિદ્ધ કરવા સારુ).
- (૧૩) પો.ઇન્સ.શ્રી, સુરત રેલ્વે પો.સ્ટે.
- (૧૪) રજુસ્ટ્રારશ્રી, હાઇકોર્ટ, ગુ.રા., સોલા રોડ, અમદાવાદ.
- (૧૫) રજુસ્ટ્રારશ્રી, ડીસ્ટ્રીક્ટ એન્ડ સેશન્સ કોર્ટ, સુરત .
- (૧૬) રજુસ્ટ્રારશ્રી, ચીફ જયુડિશિયલ મેજુ.શ્રી, સુરત શહેર. ( નાનપુરા બહુમાળી સુરત )
- (૧૭) વધારાના એક્ઝિક્યુટિવ મેજુ.શ્રી, સુરત શહેર. ( નાનપુરા બહુમાળી સુરત )
- (૧૮) સબ ડીવીઝનલ મેજુ.શ્રી, સીટી પ્રાંત. ( જીલ્લા સેવા સંદર્ભ અઠવાલાઇન્સ સુરત
- (૧૯) સંયુક્ત માહીતી નિયામકશ્રી, સુરત ( સ્થાનિક વર્તમાનપત્રો, આકાશવાણી તથા દુરદર્શન કેન્દ્રમાં પ્રસિદ્ધ કરવા સારુ.)